



**ADITYA BIRLA
CAPITAL**

Ref: No. ABCL/SD/MUM/2025-26/SEPTEMBER/11

16 September 2025

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai 400 001

Scrip Code: 540691

Scrip ID: ABCAPITAL

National Stock Exchange of India Ltd

Exchange Plaza, 5th Floor,
Plot. C/1, G-Block,
Bandra-Kurla Complex,
Bandra (East),
Mumbai 400 051

Symbol: ABCAPITAL

Dear Sir/ Madam,

Sub: Newspaper Advertisement regarding the Notice of Postal Ballot and Remote e-voting

Pursuant to the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper advertisement published today i.e. 16 September 2025, in Business Standard, All India Editions in English and Sandesh Rajkot Edition in Gujarati regarding the Notice of Postal Ballot of the Company, informing about remote e-voting and other related information.

The copies of newspaper advertisements are also being made available on the website of the Company i.e. <https://www.adityabirlacapital.com/investor-relations/announcements-and-updates>

The above is for your information, records and dissemination please.

Thanking you,

Yours sincerely,
For **Aditya Birla Capital Limited**

Santosh Haldankar

Company Secretary & Compliance Officer

Encl.: As above

Cc:

Luxembourg Stock Exchange

Market & Surveillance Dept.,
P.O. Box 165, L-2011 Luxembourg,
Grand Duchy of Luxembourg

Citi Bank N.A.

Custodial Services
FIFC, 11th Floor, C-54 & 55, G Block
Bandra Kurla Complex
Bandra (East), Mumbai 400 051

Citi Bank N.A.

Depository Receipt Services
388 Greenwich Street
14th Floor, New York,
NY 10013

Listing Agent

Banque Internationale à Luxembourg SA
69 route d'Esch
L - 2953 Luxembourg
Grand Duchy of Luxembourg

Aditya Birla Capital Limited

Corporate Office:

One World Center, Tower 1, 18th Floor, Jupiter Mill Compound,
841, Senapati Bapat Marg, Elphinstone Road, Mumbai, Maharashtra - 400 013

Tel: +91 22 6723 9101 | abc.secretarial@adityabirlacapital.com | www.adityabirlacapital.com

For customer care and other queries : care.finance@adityabirlacapital.com

Toll-free no.: 1800-270-7000

Registered Office:

Indian Rayon Compound,
Veraval, Gujarat – 362 266

Tel: +91 28762 43257

CIN: L64920GJ2007PLC058890

PUBLIC NOTICE
Lost of SHARE Certificate
Notice is hereby given that share certificate of Eaze zone Laxmi Singh complex premises co-op. soc. Ltd, Unit No.1031 Off Link Road, Opp. Ozono Towers, Goregaon west, Mumbai 400104. Standing in name of Mr. Harish Moolchand Vyas and MRS. Santosh Harish Vyas has been lost/misplaced.
Share certificate is not mortgaged nor any loan is taken against property and FIR for same is registered vide Mumbai police LR No 76967-2025 dt 15/09/2025, An application for Issue of duplicate share certificate in respect of which has been made to the society.

ROAD INFRASTRUCTURE DEVELOPMENT COMPANY OF RAJASTHAN LTD.
701-706, 7th Floor, ARG Corporate Park, Gopalbari, Ajmer Road, Jaipur - 302 001
Tel.: +91-141-2747001, E-mail: office@rdcor.in, Website: www.rdcor.in, CIN: U45203RJ2004PLC019850

RIDCOR/PRJ/ADM/NEW-519/2025/420
NIT
September 15, 2025
RIDCOR intends to invite online tender through e-procurement for Upgradation of Existing State Highway-25 from 4-Lane to 6 Lane including construction of drain for the stretch between Tapukara (Km 212+800) to Bhiwadi (Km 221+350) in the state of Rajasthan. Bid documents may be downloaded from the website 'http://eproc.rajjasthan.gov.in' from 17.09.2025 (17:00 Hrs) to 06.10.2025 (18:00 Hrs). Online bids will be opened on 07.10.2025. All the particulars and amendments related to this E-NIT can be viewed on the above said website. The document is also available on Employer's website www.inlinindia.com & www.ridcor.in. Director

GVK
Regd. Office: Plot No. 10, Paigah Colony, Sardar Patel Road, Secunderabad-500003, Telangana, India CIN U40109TG1997PLC028483

GVK Power (Goindwal Sahib) Limited
(A wholly owned subsidiary of Guru Amar Das Thermal Power Limited, GATPL)
(A step down wholly owned subsidiary of Punjab State Power Corporation Limited, PSPCL)
HOD - CHP-Operation, GATP, Goindwal Sahib, invites E-Tender for the AMC of:
Tender Enquiry No. 070GATP/CHP-Operation/50007442 dated 15/09/2025
1) "Skid Steer loader (Bobcat) required for CHP housekeeping purpose" at 2X270 MW Guru Amardas Thermal Plant (GATP), Goindwal Sahib, Distt.: Tarn Taran, Punjab as per details given in the tender specifications.
For detailed NIT & Tender specifications, please refer to https://eproc.punjab.gov.in from 15/09/2025 from 17:00 Hrs. onwards.
Note: Corrigendum and addendum, if any, will be published online at https://eproc.punjab.gov.in
1079/12/2025-26/3163

'FORM 'Z'
(See sub-rule [11(d-1)] of rule 107)
Possession Notice for Immovable Property
Whereas the undersigned being the Recovery officer of the Mumbai District Central Co-operative Bank Ltd. under the Maharashtra Co-operative Societies Rules, 1961 issued a demand notice dated 29/05/2021 calling upon the judgment debtor.
Shri. Ahire Ramesh Yashwant (Borrower) Smt. Ahire Priti Ramesh (Co- borrower) to repay the amount mentioned in the notice being **Rs.12,28,530/- (Rupees Twelve Lakhs Twenty Eight Thousand Eight Hundred & Thirty Only)** with date of receipt of the said notice and the judgment debtor having failed to repay the amount, the undersigned has issued a notice for attachment dated 14/07/2023 and attached the property described herein below.
The judgment debtor having failed to repay the amount, notice is hereby given to the judgment debtor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under rule 107 [11(d-1)] of the Maharashtra Co-operative Societies Rules, 1961 on this 03 Day of sept. of the year 2025.
The judgment debtor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Mumbai District Central Co-operative Bank Ltd., for an amount Rs. 7,09,860/- (as dt. 30/08/2025 (Rupees Seven Lakhs Nine Thousand Eight Hundred Sixty Only) and interest thereon.
Description of the Immoveable Property
Pragati Co-op. Hsg. Sty. Ltd., Building No.01, Flat No.10, A Wing, S. J. Barve Marg, Chembur, Mumbai - 400071.
All that part and parcel of the property consisting **Pragati Co-op. Hsg. Sty. Ltd., Building No.01, Flat No.10, A Wing, S. J. Barve Marg, Chembur, Mumbai - 400071.** Within the registration Tashil - Mumbai and District - Mumbai.
Date: 03.09.2025
Place: Mumbai
Sd/-
(T. S. PAWAR)
Special Recovery & Sales Officer,
(U/s 107 of Maharashtra Co. Op Sty. Act 1960 & Relus 1961)

IFB AGRO
CIN: L01409WB1982PLC034590
Regd. Office: Plot No.-IND 5, Sector-1, East Kolkata Township, Kolkata-700107
Ph: 033-39849675; Email: complianceifbagro@ifbglobal.com
Website: www.ifbagro.in

NOTICE OF SPECIAL WINDOW FOR RE-LODGE- MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES
NOTICE IS HEREBY GIVEN THAT Securities Exchange Board of India ("SEBI") vide its Circular dated July 02, 2025 has introduced a one-time special window for re-lodgement of transfer requests for physical shares.
Pursuant to the said Circular, shareholders who had submitted transfer requests for physical shares prior to April 01, 2019 (the date from which transfer of securities in physical form was discontinued) and whose requests were rejected due to deficiencies are now provided an opportunity to re-lodge such transfer request.
Eligible shareholders may re-lodge their earlier requests with the Company's Registrar and Share Transfer Agent (RTA) **C B Management Services (P) Ltd** alongwith requisite documents and rectifying the deficiency, if any, during the one-time special window period i.e from July 07, 2025 till January 06, 2026. Shareholders are informed that pursuant to said circular the securities relodged for transfer shall be issued only in demat mode after following due process for such transfer-cum-demat requests.
Shareholders can send the documents on any addresses given below :
IFB AGRO INDUSTRIES LIMITED
To, The Company Secretary
Regd. Office: Plot No.-IND 5, Sector-1, East Kolkata Township, Kolkata - 700107
Ph: 033-39849675
Email: complianceifbagro@ifbglobal.com
C B Management Services (P) Ltd.
Registrar and Share Transfer Agent (RTA)
Rasoi Court, 5th Floor, 20 R. N. Mukherjee Road, Kolkata - 700001
Ph: (033)-69066200
Email: rta@cbsmls.com
We urge all the shareholders who had submitted transfer requests in the past and are yet to receive transferred shares due to deficiencies, to take benefit of this Special Window introduced in the benefit of the shareholders.
The detailed circular is also available on the website of the Company at **www.ifbagro.in**
For IFB Agro Industries Limited
Sd/-
(Kuntal Roy)
Company Secretary
Place : Kolkata
Date: 15.09.2025

EQUITAS SMALL FINANCE BANK LIMITED
Notice seeking 'Expression of Interest' from Asset Reconstruction Companies (ARCs), Banks and NBFCs for sale of Secured Financial Assets by Equitas Small Finance Bank Limited (ESFB)
Equitas Small Finance Bank Limited (ESFB) invites Expression of Interest (Eoi) from ARC's, Banks and NBFCs for its proposed sale of the following stressed loan pool. Eligible prospective buyers are requested to intimate their willingness to participate by way of an Eoi in the format provided by ESFB and provide a Non-Disclosure Agreement (NDA) in the format provided by ESFB and copy of Registration Certificate issued by Reserve Bank of India (RBI) along with Eoi.
The Stressed Loans shall be sold on 'As is, Where is', "whatever there is and as is what is" basis without any recourse to ESFB.
(Amount in Rs. Cr as on 31st Aug 2025)


Title of account ("Stressed Assets")	No. of A/c's	Aggregate Principal O/s as on 31.08.2025	Reserve Price	Terms of Sale
Portfolio of Stressed Secured Loans	4,128	Rs. 228.99	To be communicated after submission of EOI & NDA	Cash or Cash+SR Basis

The timelines for sale are as under:-

Sr. No.	Activity	Dates
1	Period of due diligence by prospective bidder including receipt of queries, if any(*)	16.09.2025 to 23.09.2025 (till 12:00 noon)
2	Bid Submission	23.09.2025 till 12:00noon
3	Bid Opening, Negotiations and Declaration of highest bidder	23.09.2025 @ 1:00 PM
4	Fund Transfer and Execution of Assignment/Agreement	24.09.2025 onwards

ESFB may extend any or all the above timelines at any time at its sole discretion, without assigning any reason whatsoever. If ESFB decides to extend any of the above timelines, the same would be put up in the website of ESFB.

- The format of NDA and EOI can be obtained from **Mr. V. Vinodh Kumar** (or) **Mr. Iqbal Alam**, Equitas Small Finance Bank Limited, 4th floor, Phase II, Spencer Plaza, No.769, Mount Road, Anna Salai, Chennai - 600002. (Email Id: **vinodhkumarv@equitasbank.com** & **iqbal.alam@equitasbank.com**). Thereafter, the prospective buyers can undertake the due diligence at their own cost.
- Upon receipt of Eoi and NDA, the detailed sale process note and information pertaining to the NPA accounts offered for sale, Access to virtual data room / data & documents for due diligence would be shared with the eligible bidders.
- ESFB reserves the right to sell these assets in whole or in part, in one or multiple pools, to include additional assets to and / or withdraw certain assets or all the assets, at its sole discretion, without assigning any reasons at any stage of transaction.
- The cut-off date for the sale of the abovementioned assets shall be specified separately at the time of final bid submission as part of the sale process.
- All costs, expenses, taxes, stamp duties and liabilities incurred by each Bidder in connection with the Transaction, including (without limitation) in connection with Due Diligence, preparation and/or submission of the Bid, including fees of its own advisors, if any, shall be borne and paid by such Bidder, whether its Bid is accepted or rejected for any reason and ESFB does not assume any liability whatsoever in this connection.
- ESFB reserves the right to terminate the sale/auction process at any point of time without prescribing any reason thereof, at its own discretion. The decision of ESFB shall be final and binding in this regard
- Evaluation of Bids received and any sale under this process shall be subject to ESFB's parameters, evaluation criteria and final approval by the Competent Authority of ESFB.
- The above stated sale of stressed loans shall be in compliance with relevant RBI and other regulatory requirements.

**PRECISION CAMSHAFTS LIMITED**
CIN: L24231PN1992PLC067126
Regd. Office: D-5, Chincholi MIDC, Solapur - 413255, Maharashtra, India
Phone: +91 9168646536/37, Fax: +91 0217 2357645
Email-cs@pclindia.in, Website: www.pclindia.in

NOTICE OF POSTAL BALLOT
Pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014]
Members of the Company are hereby informed that a Postal Ballot Notice, seeking members' consent on the resolution set out in the said notice has been sent electronically to the members whose name appears in the Register of Members/ List of Beneficial Owners as on **Friday, September 12, 2025** i.e. the cut-off date. The Company completed electronic dispatch of the Postal ballot notice on **Monday, September 15, 2025**.
The Postal Ballot notice is available on the Company's website at **www.pclindia.in** and on the website of the Stock Exchanges, that is BSE Limited and National Stock Exchange of India Limited at **www.bseindia.com** and **www.nseindia.com**, respectively and on the website of National Securities Depository Limited (NSDL) at **www.evoting.nsdl.com**. Members who did not receive the Postal ballot notice may download it from the above-mentioned websites.
The documents referred to in the Postal ballot notice are available for inspection electronically and members seeking to inspect such documents can send an e-mail to **cs@pclindia.in**.
Members may cast their votes electronically on the businesses set forth in the Postal Ballot Notice through electronic voting system of NSDL. The details of remote e-voting are as under:
1. In accordance with the applicable circulars issued by Ministry of Corporate Affairs, the Company is providing to its members the facility to exercise their right to vote on the resolution proposed in the said Postal Ballot notice only by electronic means ("e-voting"). The communication of the assent or dissent of the members would take place through remote e-voting process only. The Company has engaged the services of NSDL as the agency to provide e-voting facility. Members may cast their votes during the period mentioned herein below:
2. The remote e-voting commences on **Tuesday, September 16, 2025 at 09.00 AM (IST)** and ends on **Wednesday, October 15, 2025 at 5:00 PM (IST)**.
3. The cut-off date for determining the eligibility to vote by electronic means was **Friday, 12th September 2025**. The Voting rights shall be reckoned in proportion to the paid-up equity shares held by Members as on the cut-off date. A person who becomes a member after the Cut-off date should treat this notice for information purpose only.
4. The remote e-voting shall not be allowed beyond 5:00 p.m. on **Wednesday, October 15, 2025**.
5.Process for procuring user ID and password and registration of email ids for e-voting on the resolutions is set out in the notes to the Notice of Postal Ballot for those shareholders who hold shares in physical mode or whose email IDs are not registered with their depositories.
6. The resolution if approved, shall be deemed to have been passed on the last date of e-voting i.e. **Wednesday, October 15, 2025**. The results of e-voting will be announced on or before **Friday, October 17, 2025** and will be displayed at its Registered Office, Corporate Office and website www.pclindia.in, and communicated to the Stock Exchanges.
7. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of **www.evoting.nsdl.com** or call on toll free no. 022 - 4886 7000 and 022 - 2499 7000 or send a request at **evoting@nsdl.co.in**
Place : Solapur
Date : 15th September 2025
For **Precision Camshafts Limited**
Sd/-
Harshal J. Kher
Company Secretary & Compliance Officer

Aditya Birla Capital Limited
Regd. Office: Indian Rayon Compound, Veraval - 362 266, Gujarat | Tel: 91 2876 243257
CIN: L64920GJ2007PLC058890 | www.adityabirlacapital.com | abc.secretarial@adityabirlacapital.com

**ADITYA BIRLA CAPITAL**

POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION
Notice is hereby given that pursuant to and in compliance with the provision of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 (the 'Act'), Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the 'Rules'), Secretarial Standard-2 on General Meetings (the 'SS-2') issued by the Institute of Company Secretaries of India ('ICSI') and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the 'SEBI Listing Regulations') (including any statutory modification(s) or amendments(s) or re-enactment thereof for the time being in force), guidelines prescribed by the Ministry of Corporate Affairs (the 'MCA') vide General Circular Nos. 14/2020 dated 08 April 2020, 17/2020 dated 13 April 2020, read with other relevant circulars, including General Circular No. 09/2024 dated 19 September 2024 (the 'MCA Circulars') and other applicable laws and regulations, the Aditya Birla Capital Limited ('the Company') is seeking approval of the Members of the Company by way of postal ballot through remote e-voting for the following special businesses:

Sr. No.	Particulars	Type of Resolutions
1	Appointment of Ms. Vishakha Mulye (DIN: 00203578) as Managing Director and Chief Executive Officer of the Company, and fixation of remuneration	Ordinary
2	Appointment of Mr. Rakesh Singh (DIN: 07006067) as Executive Director and Chief Executive Officer (NBFC) of the Company, and fixation of remuneration	Ordinary

In accordance with the MCA Circulars, the Postal Ballot Notice along with the Explanatory Statement ('the Notice') has been sent via email on **Monday, 15 September 2025**, through electronic mode only to those Members whose names appear in the Register of Members/Register of Beneficial Owners as on **Friday, 12 September 2025 ('Cut-off Date')** received from the Depositories viz. National Securities Depository Limited /Central Depository Services (India) Limited and whose e-mail address are registered with the Company/Company's Registrar and Transfer Agent i.e., KFin Technologies Limited ('KFinTech')/Depositories.
In accordance with the MCA Circulars, the physical copies of the Notice, along with postal ballot forms and pre-paid business envelope, has not been sent to any Member. A person whose name is recorded in the Register of Members / Register of Beneficial Owners as on the cut-off date shall only be entitled to cast their vote by remote e-voting. A person who becomes a Member after the cut-off date should treat the said Postal Ballot Notice for information purpose only. Accordingly, the communication of the assent or dissent of the Members eligible to vote is restricted only to voting through electronic means ('remote e-voting')
Instructions for remote e-voting
a. The Company has engaged the services of KFinTech as the agency to provide remote e-voting facility. Detailed instructions for remote e-voting are provided as part of the Notice which the members are requested to read carefully before exercising their vote.
b. The Members may cast their votes during the period mentioned below:

Commencement of e-voting:	9.00 A.M. (IST) on Tuesday, 16 September 2025
End of e-voting:	5.00 P.M. (IST) on Wednesday, 15 October 2025

c. The e-voting will not be allowed beyond the aforesaid date and time and the e-voting module shall be forthwith disabled by Scrutinizer upon expiry of the aforesaid period.
d. Once the vote is casted on the resolution, the Member will not be allowed to change it subsequently or cast the vote again.
e. In case of any queries, Members may visit Help and FAQs section available at KFinTech website **https://evoting.kfintech.com**. For any grievances related to remote e-voting, please contact Mr. Ganesh Patro, Deputy Vice President, KFin Technologies Limited, Selenium Building, Tower-B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Rangareddy, Hyderabad 500 032, Telangana, India, Email Id: **einward.ris@kfintech.com**, Phone No.: + 91 40 67161630 and Toll Free No. 1800 309 4001.
The Notice is also available on the Company's website at **https://www.adityabirlacapital.com/investor-relations/announcements-and-updates**, website of the Stock Exchanges, i.e., BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at **www.bseindia.com** and **www.nseindia.com** respectively, and on the website of KFinTech at **https://evoting.kfintech.com/**.
Mr. Vaibhav Dandawate (ACS No: 51538), failing him, Mr. Saurabh Agarwal (FCS No.: 9290), Designated Partners of M/s. Makarand M. Joshi & Co. (Firm Registration No. P2009MH007000), Practicing Company Secretaries have been appointed as the Scrutinizer for conducting the Postal Ballot through remote e-voting process only in a fair and transparent manner.
The Scrutinizer shall submit his report to the Chairman of the Company, or any person authorized by him upon completion of the scrutiny of the votes cast through remote e-voting. The result of remote e-voting will be announced on or before Friday, 17 October 2025. The results will be posted on the website of the Company **https://www.adityabirlacapital.com/**, website of Stock Exchanges i.e., BSE and NSE at **www.bseindia.com** and **www.nseindia.com**, respectively and on the website of KFinTech at **https://evoting.kfintech.com**.
The Resolutions, if approved by requisite majority, shall be deemed to have been passed on the last day of e-voting i.e. **Wednesday, 15 October 2025**.
Members who have not yet registered their e-mail address may register the same as under:
1. Members holding shares in physical mode are requested to register/ update their e-mail address and other KYC details, if applicable, by sending request at **einward.ris@kfintech.com** (if email is already registered) or sending physical documents along with Form ISR-1 and other relevant forms and documents to KFin Technologies Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad 500 032. The format of Form ISR-1 is available on the website of KFinTech at **https://ris.kfintech.com/client-services/isc/isrforms.aspx**.
2. Members holding shares in dematerialised mode are requested to register/ update their e-mail address(es) with the Depository Participant(s) with whom they maintain their demat accounts.
Members are requested to carefully read all the notes set out in the Postal Ballot Notice and in particular manner of casting vote through remote e-voting.

For **ADITYA BIRLA CAPITAL LIMITED**

Santosh Haldankar
Company Secretary
Membership No. **A19201**

Place: Mumbai
Date : 15 September 2025

— TENDER CARE — Advertorial

J&K BANK HOSTS STRATEGIC CUSTOMER MEETS ACROSS DELHI ZONE



Jammu & Kashmir Bank organized multiple Corporate Customer Meets across key locations in the Delhi zone, aimed at reinforcing partnerships with corporate clients and addressing their evolving business requirements. Conducted over the last two days, MD & CEO Amitava Chatterjee chaired the meetings attended by the General Manager & Divisional Head (RO) Khurshed Muzaffar, Cluster Head (Lucknow) Ashok Kumar, and other senior officials of the Bank. The events took place in Badohi, Allahabad and Varanasi, where cross-sections of valuable corporate clients from various areas of Bank's Delhi zone participated. Addressing the gatherings, Amitava Chatterjee reiterated the Bank's commitment to provide customized financial solutions and strengthen its support to businesses across sectors. He appreciated the valuable feedback shared by clients and assured them of the Bank's continued focus on operational excellence and customer-centric services. Speaking on the occasion, Amitava Chatterjee said, "Our vision is to expand the Bank's footprint beyond Jammu & Kashmir and grow our share of business from the rest of the country to about 50% particularly in the metros and emerging business centres. It will be done through a two-legged model where cutting-edge digital services are seamlessly complemented by highly personalized, humane, and efficient brick-and-mortar support. This approach will ensure that every customer feels valued, empowered and supported at every step." Divisional Head Khurshed Muzaffar highlighted the Bank's role in facilitating growth opportunities and providing timely assistance to corporate customers. The senior officials also reiterated the Bank's resolve to enhance customer experience by leveraging innovative solutions and improving service delivery. The participants at the meetings expressed appreciation for the Bank's services and its renewed efforts towards deepening relationships with customers.

BHEL WINS FIRST PRIZE UNDER RAJBHASHA KEERTI AWARD 2024-25

BHEL has been honoured with the highest national award in the field of Official Language, the 'Rajbhasha Keerti Puraskar', by Rajbhasha Vibhag, Ministry of Home Affairs, Government of India for 'Excellent Rajbhasha Implementation' and 'Best Hindi House Journal'. These awards were received by Shri Krishna Kumar Thakur, Director (Human Resources), BHEL, from Shri Amit Shah, Hon'ble Union Minister of Home Affairs and Cooperation, during the Hindi Diwas celebration and the 5th All India Rajbhasha Conference held in Gandhinagar, Gujarat, on 14th September. Notably, BHEL's Corporate Office, New Delhi has been awarded the 'Second Prize' for 'Excellent Rajbhasha Implementation' in the category of 'Public Sector Enterprises located in A region', and BHEL's HPEP, Hyderabad unit has been honoured with the 'First Prize' for 'Best Hindi House Journal' in the category of 'Public Sector Enterprises located in C region'.



HUDCO – POWERING PROGRESS TO REALIZE VIKSIT BHARAT

Housing and Urban Development Corporation Limited, a Navratna NBFC-IFC, held its 55th Annual General Meeting (AGM) at HUDCO Bhawan through video conferencing. Chairing the AGM, Shri Sanjay Kulshrestha, CMD, HUDCO, said that as India steadily progresses towards becoming the third-largest economy globally, HUDCO remains a committed partner in realising the national vision of Viksit Bharat@2047. He reiterated HUDCO's target of extending over ₹3 lakh crore in infrastructure finance by 2030, spanning affordable housing, clean energy, urban mobility, roads, ports and all core infrastructure access. Highlighting the organisation's robust performance, Shri Kulshrestha credited HUDCO's success to strategic foresight, sound risk management, and innovation-driven policies. With these initiatives, this year, the Company has delivered a historic operational and financial performance, marking a significant milestone in its journey of growth and transformation.



BANK OF INDIA'S 120-YEAR JOURNEY: HONOURING HERITAGE, DRIVING THE FUTURE OF BANKING

Bank of India, one of India's trusted public sector banks, celebrated its 120th Foundation Day with a grand event at the Jio World Convention Center, BKC, Mumbai. The evening brought together employees, stakeholders, and partners to reflect on a legacy built on trust, which is proudly serving 120 million plus customers, and to showcase its bold agenda for the future. Speaking at the occasion, Shri Rajneesh Karnatak, MD & CEO, Bank of India, said, "For 120 years, Bank of India has been more than a financial institution – it has been a partner in the nation's growth story. As we step into the future, our focus is clear: to lead in digital banking, to champion inclusive growth, and to innovate for every section of society – from farmers and gig workers to corporates and the underserved. Our commitment is to serve India with agility, empathy, and vision." The celebrations marked the unveiling of next-generation banking solutions aimed at strengthening India's digital economy and financial inclusion. From powering modern agriculture with the Star Agri Smart Finance Scheme, to enabling seamless trade through the BOI TradeEasy Platform, and pioneering exclusive products for gig workers, Bank of India positioned itself as a bank of the future, rooted in its century-old values. The introduction of a Braille Debit Card reaffirmed the bank's dedication to accessibility and inclusivity, while the Star Vyapar Shakti Current Account and Omni Neo Corporate Internet Banking underlined its commitment to empowering entrepreneurs and corporates with secure, tech-driven solutions. Beyond banking, the evening also highlighted the institution's social conscience. In the presence of the Board and senior leadership, CSR contributions were extended to: ●The Jaan Foundation Trust to support shelter homes for victims of abuse and trafficking ●Dabewala Roti Foundation to strengthen hunger eradication and food-distribution programs in Mumbai The bank also celebrated excellence beyond finance, felicitating Ms. Nayana Sri Talluri, Asian Open Short-Track Speed Skating Championship medalist, for her sporting achievements. Cultural performances by the Sunil Sale Troupe and a vibrant concert by Sukhwinder Singh and his band capped the evening with energy and pride, symbolizing both tradition and forward momentum

